



DAM-1601270301040902 Seat No. _____

B. A. (Sem. IV) (W.E.F. 2016) Examination

April - 2022

Psychology

(Health Psychology-2) (Eletive-II)

(Old Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : બધા પ્રશ્નો ફરજિયાત છે.

- | | | |
|-------------|---|----|
| 1 | સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વાસ્થ્ય માન્યતા મોડેલ સમજાવો. | 14 |
| અથવા | | |
| 1 | સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો વિકાસ સમજાવો. | 14 |
| 2 | સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું મનોસાંસ્કૃતિક મોડેલ સમજાવો. | 14 |
| અથવા | | |
| 2 | સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એટલે શું ? તેના સ્વરૂપની સમજૂતી આપો. | 14 |
| 3 | તર્કયુક્ત કાર્યનો સિદ્ધાંત સમજાવો. | 14 |
| અથવા | | |
| 3 | સ્વ-નિયમનનો સિદ્ધાંત સમજાવો. | 14 |
| 4 | સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન તરીકે કસરતની ભૂમિકા સમજાવો. | 14 |
| અથવા | | |
| 4 | હૃદયરોગનું વ્યવસ્થાપન સમજાવો. | 14 |
| 5 | ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) | 14 |
| | (1) મનોભાર | |
| | (2) ડાયાબિટીસ | |
| | (3) જૈવ તબીબી મોડેલ | |
| | (4) આયોજિત વર્તનનો સિદ્ધાંત | |

ENGLISH VERSION

Instruction : All questions are compulsory.

1 Explain the Health belief model of health psychology. 14

OR

1 Explain development of health psychology. 14

2 Explain the psycho-cultural model of health psychology. 14

OR

2 What is health psychology ? Explain its nature. 14

3 Explain the theory of reasoned action. 14

OR

3 Explain self-regulation theory. 14

4 Explain the role of exercise as health improving behavior. 14

OR

4 Explain management of Heart disease. 14

5 Write short notes : (any two) 14

(1) Stress

(2) Diabetes

(3) Biomedical model

(4) Theory of Planned behavior